

# Day to Day Current Affairs

૫.તાજેતરમાં યોજાયેલ ઇન્ડોનેશિયા બેડમિંટન ટુર્નામેન્ટમાં શ્રીકાંત ક્યા સ્થાને રહ્યો હતો. ? ..... રનર્સ અપ.  
૬. 26મી જાન્યુઆરી, 2016 પ્રજાસત્તાક દિનની રાજ્યકક્ષાની ઉજવણી ક્યાં યોજાશે? .... ગીર સોમનાથ.

7.Dec 2015

## ૧. સશસ્ત્ર સેના ધ્વજદિન :

- આ દિવસે નાગરિકો, સરકારી અને અર્ધસરકારી કચેરીઓ, ઔદ્યોગિક એકમો, ખાનગી ક્ષેત્રે તેમજ શૈક્ષણિક સંસ્થાઓ પાસેથી દાન સ્વરૂપે ભંડોળ એકત્ર કરવામાં આવે છે.
- આ એકત્રિત ભંડોળ દેશની સરહદોનું રક્ષણ કરતા જવાનો, શહીદ જવાનોના પરીવારજનો, ઘવાયેલા સૈનિકો સ્વ. સૈનિકોના ધર્મપત્નિઓ, પૂર્વ સૈનિકોના કલ્યાણ અર્થે ઉપયોગમાં લેવામાં આવે છે.

## ૨. ખંભાળીયાની યુવતીને ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ

### રેકોર્ડમાં સ્થાન :

- ખંભાળીયાના બાંધણીના વ્યવસાય સાથે સંકળાયેલા સુરેશભાઈ ભૂતની પુત્રી ધારાએ બાંધણી, સિલ્ક કાપડ, મોતી, ઉનના બોલ્ટ, કળશ, આભલા વગેરે મૂળભૂત ચીજ વસ્તુઓ સુશોભન માટે ઉપયોગમાં લઈ 72.69 મીટર લાંબુ તોરણ બાનાવ્યું.
- તેની આ સિધ્ધિને ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે.

## ૩. શ્રીકાંત - બેડમિંટન પ્લેયર :

- ભારતીય બેડમિંટન સ્ટાર કિદામ્બી શ્રીકાંત ઇન્ડોનેશીયા બેડમિંટન ટુર્નામેન્ટમાં રનર્સ અપ રહ્યો હતો.
- ફાઇનલમાં તેનો ઇન્ડોનેશિયાના ટોમી સુગીએટો સામે પરાજય થયો હતો.

## ૪. પ્રજાસત્તાક દિનની રાજ્યકક્ષાની ઉજવણી :

- આ વખતે 26મી જાન્યુઆરીના પ્રજાસત્તાક દિનની રાજ્ય કક્ષાની ઉજવણી નવ રચિત જિલ્લા ગીર સોમનાથ ખાતે થશે.  
પ્રશ્નો
- ૧.7 ડિસેમ્બરના રોજ કયો દિવસ મનાવાયો ?..... સશસ્ત્ર સેના ધ્વજદિન
- ૨.સશસ્ત્ર સેના ધ્વજદિને કઈ કાર્યવાહી હાથ ધરાય છે ? ...  
નગરિકો તેમજ સરકારી અને ખાનગી ક્ષેત્રે દાન સ્વરૂપે ભંડોળ એકત્ર કરી સેના જવાનોના કલ્યાણ અર્થે ઉપયોગમાં લેવાય છે.
- ૩.તાજેતરમાં ગુજરાતની કઈ યુવતીને બાંધણીનું 72.69 લાંબુ તોરણ બનાવવા બદલ ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું ? ..... ધારાભૂત
- ૪.કિદામ્બી શ્રીકાંત કઈ રમત સાથે સંકળાયેલ છે ?..... બેડમિંટન